

તમારી ચિંતામુક્ત નિવૃત્તિ માટેનો રોડ મેપ

તમે બજાને ટ્રેક કરો છો, કમાણીના અંદેવાલોનું વિશ્લેષણ કરો છો અને આલ્ફા અને બીટાની અત્યાધુનિક ભાષા બોલો છો. તમે એક શિસ્તબદ્ધ રોકાણકાર છો - નાણાકીય દુનિયામાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર.

છતાં, એક ભંડોળ એક માનસિક પ્રશ્ન ખતરનાક રીતે ઉકેલાયો નથી: શું તમારી મહેનતથી મેળવેલી સંપત્તિ ખરેખર તમને સ્વતંત્રતા ખરીદે છે, કે ફક્ત સુરક્ષાનો ભ્રમ છે?

જીવનમાં સૌથી મોટી વૈભવીતા એ નિવેદન પરનો આંકડો નથી; તે ખાતરી છે કે તમારી સંપત્તિ તમારાથી વધુ ટકી રહેશે. છતાં, ડેટા એક આવનારી કટોકટી દર્શાવે છે: આશ્ચર્યજનક 72% વ્યક્તિઓ નિવૃત્તિમાં તેમના પરિવાર પર સંભવિત નિર્ભરતા વિશે ચિંતા વ્યક્ત કરે છે.

ખરેખર ચિંતામુક્ત નિવૃત્તિ એ એક એન્જિનિયર્ડ પરિણામ છે, નસીબનો પ્રહાર નથી. આ લેખ ત્રણ સ્તંભોની રૂપરેખા આપે છે જે તમારે વ્યૂહાત્મક, સ્થિતિસ્થાપક માળખું બનાવવા માટે જરૂરી છે, ખાતરી કરે છે કે તમારા પૈસા તમારા કરતા વધુ સમત કામ કરે છે, શિસ્તબદ્ધ રોકાણ અને નિષ્ણાત માર્ગદર્શન દ્વારા સમર્થિત છે.

નિવૃત્તિ મૂલ્યાંકન શા માટે વાટાઘાટી કરી શકાતું નથી? : નવી વાસ્તવિકતા

અમે વિવિધ જરૂરિયાતો માટે રોકાણ કરીએ છીએ - બાળકોની શિક્ષણ, ઘર ખરીદી, વેકેશન. પણ નિવૃત્તિ? તે સામાન્ય રીતે ચાંદીમાં સૌથી છેલ્લે હોય છે.

આપણે નિવૃત્તિને પ્રાથમિકતા આપવી જોઈએ કારણ કે:

» વિજ્ઞાન અને દવામાં પ્રગતિને કારણે આપણે લાંબા સમય સુધી જીવવાની અપેક્ષા રાખીએ છીએ.

» વધતા તબીબી ખર્ચ માટે મજબૂત નાણાકીય તકિયોની જરૂર પડશે.

પરંપરાગત સંચુક્ત પરિવારોથી વિપરીત, બાળકો આપણી સાથે ન રહેતા હોય શકે.

ભારતમાં કોઈ સાર્વત્રિક સામાજિક સુરક્ષા નથી.



કરો તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) તમારા વ્યક્તિગત, કુળાવા-સમાયોજિત લક્ષ્યની ગણતરી કરી શકે છે, ખાતરી કરે છે કે તમે ફક્ત રૂ. 1 કરોડના બેન્ચમાર્ક માટે જ નહીં, પણ તમને જોઈતા નાણાં માટે લક્ષ્ય રાખો છો.

સ્તંભ 2: ગ્રોથ એન્જિન-લિવરેજિંગ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ

ફિક્સ્ડ ડિપોઝિટ જેવા પરંપરાગત માર્ગો સામાન્ય રીતે સ્થિર અને અનુમાનિત વળતર આપે છે, પરંતુ આ ક્યારેક ભારતના લાંબા ગાળાના સરેરાશ કુળાવાના દર 6.92% સાથે ગતિ બળવા માટે સંઘર્ષ કરી શકે છે. બીજી બાજુ, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળા દરમિયાન ઉચ્ચ કુળાવા-સમાયોજિત વળતર ઉત્પન્ન કરવાની ક્ષમતા દર્શાવી છે કારણ કે તેઓ વ્યવસાયોના વિકાસ અને વ્યાપક અર્થતંત્રમાં ભાગ લે છે.

સ્તંભ 3: માર્ગદર્શન પરિબળ - તમારું MFD શા માટે આવશ્યક છે?

એસેટ ક્લાસ (માર્ચ 1979- માર્ચ 2025)	રૂ. ૧,૦૦,૦૦૦ રોકાણનું વાર્ષિક મૂલ્ય
સોનુ બેન્ક ડિપોઝિટ સેન્સેક્સ (ઇક્વિટી)	રૂ. 95,85,434
	રૂ. 37,78,888
	રૂ. 7,74,14,920

સ્ત્રોત: RBI - માર્ચ 2025 સુધીનો કુળાવાનો ડેટા (નોંધ: 2012-13 પહેલાંના કુળાવાનો ડેટા WPI દર મુજબ લેવામાં આવ્યો છે અને 2012-13 CPIrate ગણવામાં આવે છે.)|સ્ત્રોત:-RBI-Gold&Silverd ataasonMar2025|સ્ત્રોત:-RBI-BankDeposits & Co. સપ્ટેમ્બર 2025 સુધીનો ડિપોઝિટ ડેટા || માર્ચ 2025 સુધીનો સેન્સેક્સ ડેટા - સ્ત્રોત BSE

નિવૃત્તિ દરમિયાન, તમારી ચોજના સંચયથી આવક ઉત્પન્ન તરફ બદલવી જોઈએ. સિસ્ટેમેટિક વિડોઅલ પ્લાન (SWP) નિયમિત માસિક આવક મેળવવાની મંજૂરી આપે છે, જ્યારે ભાડાની મિલકત અથવા બેંક FD થી વિપરીત, સંભવિત મૂડી વૃદ્ધિનો લાભ પૂરો પાડે છે. આવક માટે, આદર્શ ભંડોળ સંતુલિત લાભ, મલ્ટી-એસેટ અને આક્રમક ઇઍફિડ ફંડ્સ છે.

જ્યારે નાણાકીય ઉત્પાદનોની સ્વ-બગીચામાં સુધારો થયો છે, ત્યારે અમલીકરણની જટિલતાને વ્યાવસાયિક મદદની જરૂર છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર (MFD) જાગૃતિ અને કાર્યવાહી વચ્ચેનો મહત્વપૂર્ણ સેતુ છે. તમારું MFD:

» તમને તમારી નિવૃત્તિ જરૂરિયાતોને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં અને તમને ખરેખર કેટલા ભંડોળની જરૂર પડશે તેની ગણતરી કરવામાં મદદ કરે છે.

» કુળાવાને ઠરાવવા માટે વૃદ્ધિ સુનિશ્ચિત કરતી વખતે તમારી જરૂરિયાતો અને જોખમ પ્રોફાઇલ સાથે મેળ ખાતો MF પોર્ટફોલિયો બનાવવામાં તમારી સહાય કરો.

» બજારો અસ્થિર બને ત્યારે પણ SIP દ્વારા તમારી રોકાણ

ચિંતામુક્ત નિવૃત્તિ સુસંગત સંપત્તિ સંચય અને વ્યૂહાત્મક સંપત્તિ વિતરણ વડે તમે પાકી કરી શકો છો. ખરેખર ચિંતામુક્ત નિવૃત્તિ એ એક એન્જિનિયર્ડ પરિણામ છે, નસીબનો પ્રહાર નથી

» અને સૌથી મોટો દુશ્મન: કુળાવો, જે તમારી બચતને ચૂપચાપ ખાઈ જાય છે.

તાજેતરના ડેટા તાકીદને પ્રકાશિત કરે છે.

» 77% શહેરી ભારતીયો માને છે કે શાંતિપૂર્ણ નિવૃત્તિ માટે રૂ. 1 કરોડ કે તેથી ઓછું પૂરતું છે - એક ઘોર ઓછો અંદાજ જે દાયકાઓના કુળાવાના દબાણને ગંભીરતાથી અવગણે છે.

73% શહેરી ભારતીયોને તેમની નિવૃત્તિ બચત યાત્રા શરૂ કરવા માટે સામાજિક દબાણ - મિત્રો અને પરિવાર તરફથી ચોક્કસ સાથી ભલામણોની જરૂર છે.

72% ભારતીયો નિવૃત્તિમાં પરિવાર પર આર્થિક રીતે નિર્ભર રહેવાની અપેક્ષા રાખે છે. નાણાકીય ઉત્પાદનો પ્રત્યે વધતી જાગૃતિ છતાં, ફક્ત 37% ભારતીયોએ તેમના લક્ષ્ય નિવૃત્તિ ભંડોળનો એક ચતુર્થાંશ (25%) કે તેથી વધુ હિસ્સો મેળવ્યો છે.

સ્ત્રોત : એક્સિસ મેક્સ લાઇફ IIRA અભ્યાસ.0

સ્તંભ 1 : સ્પષ્ટતા આવશ્યક-વિજયી અંદાજ

સૌથી મોટો પડકાર વધતી જતી કુળાવા અને, મહત્વપૂર્ણ રીતે, જરૂરી ભંડોળનો અંદાજ ઓછો છે. ઘણા લોકો માટે રૂ. 1 કરોડ સામાન્ય માપદંડ રહે છે તે હકીકત જાગૃતિ અને જરૂરી કાર્યવાહી વચ્ચે વિશાળ અંતરને રેખાંકિત કરે છે. ઉદાહરણ: જો તમે 30 વર્ષના છો, તો 60 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની ચોજના બનાવો છો, અને હાલમાં દર મહિને રૂ. 25,000 ખર્ચ કરો છો (દ્યારે કે 6% કુળાવો, આયુષ્ય 85 વર્ષ) - નિવૃત્તિ પછી 25 વર્ષ સુધી સમાન જીવનશૈલી ટકાવી રાખવા માટે તમારે રૂ. 3.44 કરોડની જરૂર પડશે.

કાર્યક્ષમ પગલું: વાસ્તવિક, કુળાવા-સમાયોજિત લક્ષ્ય નક્કી

અસ્વીકરણ: ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકાવી શકે છે અથવા ન પણ રહે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.



ડેટા દર્શાવે છે કે ઇક્વિટી સૌથી શક્તિશાળી સંપત્તિ નિર્માણ ક્ષમતા પ્રદાન કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સની ડ્યુઅલ પાવર (SIP&SWP)

1. સંપત્તિ સંચય (SIP): સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)

રોકાણમાં શિસ્ત લાગુ કરે છે અને રૂપિયાના ખર્ચ સંરેરાશથી આપમેળે લાભ મેળવે છે.

જો તમને 25 વર્ષ પછી નિવૃત્તિ માટે રૂ. 4.5 કરોડની જરૂર હોય, તો તમારી માસિક SIP જરૂરિયાત અહીં છે:

» 6% વળતર 66,000 પ્રતિ મહિને

» 8% વળતર 49,000 પ્રતિ મહિને

» 10% વળતર 36,000 પ્રતિ મહિને

» 12.62% વળતર 23,000 પ્રતિ મહિને

*AMFI શ્રેષ્ઠ પ્રેક્ટિસ માર્ગદર્શિકા પરિપત્ર નં. 135/ BP/109-A/2024-25 તારીખ 10 સપ્ટેમ્બર, 2024 મુજબ ઇક્વિટી ફંડમાં રોકાણ અને સંરેરાશ 12.62% વાર્ષિક વળતર ધારી રહ્યા છીએ. “ભૂતકાળનું પ્રદર્શન મેયર ભવિષ્યમાં ટકાવી શકશે નહીં અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.”

ઇક્વિટી (અને SIP શિસ્ત) માસિક બોજને નાટકીય રીતે ઘટાડે છે.

2. સંપત્તિ વિતરણ (SWP):

વ્યૂહરચના શિસ્તબદ્ધ રાખો.

» તમારા પોર્ટફોલિયોની નિયમિતપણે સમીક્ષા કરો જેથી તમારી નિવૃત્તિ જરૂરિયાતો જીવનના ફેરફારો સાથે સુસંગત રહે.

» બજારના ઘટાડા દરમિયાન SIP બંધ કરવા જેવી ભાવનાત્મક ભૂલોથી તમારું રક્ષણ કરે છે.

» જટિલ નાણાકીય ખ્યાલોને સરળ બનાવો, તમારી મુશ્કેલીને આત્મવિશ્વાસપૂર્ણ અને તણાવમુક્ત બનાવો.

» SIP (સંચય) થી SWP (નિવૃત્તિ આવક) માં તમારા બચત સંક્રમણને સરળતાથી સુનિશ્ચિત કરે છે.

» નિષ્પક્ષ, વ્યક્તિગત માર્ગદર્શન આપે છે-જેની નકલ ઓનલાઇન સાધનો અને એપ્લિકેશનો કરી શકતા નથી.

» તમારા લાંબા ગાળાના નાણાકીય ભાગીદાર તરીકે કાર્ય કરો, ખાતરી કરો કે તમારી નિવૃત્તિ આરામદાયક, સ્વતંત્ર અને ચિંતામુક્ત છે.

અંતિમ શબ્દો ચિંતામુક્ત નિવૃત્તિ સુસંગત સંપત્તિ સંચય (SIP) અને વ્યૂહાત્મક સંપત્તિ વિતરણ (SWP), અથવા વ્યાવસાયિક MFD દ્વારા રેટ કરાયેલ છાતીના સંયોજન દ્વારા સુરક્ષિત છે. વિલંબ કરશો નહીં. તમારા વ્યક્તિગત નિવૃત્તિ જરૂરિયાત મૂલ્યાંકન કરવા અને તમારી SIP + SWP યાત્રાનો નક્કશો બનાવવા માટે આજે જ તમારા MFD નો સંપર્ક કરો. ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે, રોકાણ કરતા પહેલા તમામ ચોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો. ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં ટકાઈ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે અને તે ભવિષ્યના કોઈપણ વળતરની ગેરંટી નથી.

ઘરેલું સોનું ભારતીય અર્થતંત્ર માટે ચાંદી બનશે

દુનિયાના સૌથી વિખ્યાત જહાજ ટાઇટેનિક એકીસાથે મુસાફરો અને કાર્ગો 22000 ટન જેટલું વહન કરી શકે છે પરંતુ તે ભારતીય ઘરોમાં જે સોનું છે તેને એકીસાથે વહન ન કરી શકે. હાલના ૪ મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં અંદાજ મુકાયો છે કે ભારતીય ઘરોમાં 35000 ટન સોનું સંગ્રહાયેલું છે અને તે દુનિયામાં સૌથી મોટો હાઉસહોલ્ડ ભંડાર છે અને હજુએ તે પણ વધતુ જાય છે. 2000થી 2025 દરમિયાન ભારતનું સત્તાવાર કુલ આયાત 700 ટન પ્રતિ વર્ષની રહી છે અને બે તેમાં તેમાં દાહાચોરીથી આયાત થયેલું સોનું ઉમેરો તો 507 મિલિયન ડોલર ઉપરાંત વિદેશથી આયાત મુસાફરો જે સોનું લઈ આવ્યા છે તે બંને ઉમેરો તો 700 મિલિયનનું સોનું ભારતમાં આવ્યું છે અને ઘરેલું સોનાનો પાંચ ટ્રીલીયન ડોલરનો હાલના ભાવે તમે મુકી શકો છો. જે સામાન્ય નાણાકીય સોસ્ટમ કરતા અન્ય કોઈપણ કોમોડિટીમાં રોકાયેલું સૌથી મોટો ભંડાર છે. જેનો સાચો આંકડો કદી મળતો નથી. હવે જો આ સોનાને મેઇન સ્ટ્રીમ એટલે કે તેને નાણાકીય સીસ્ટમમાં લેવામાં આવે તો સરકાર એકપણ વધારાનો ટેક્સ નાખ્યા વગર આકર્ષમાં પંચની જે ભલામણો હશે તેને અમલમાં મુકી શકશે. આ ઉપરાંત લોકોના અને વ્યાપારીઓના હાથમાં મોટું લિક્વિડ ભંડોળ પણ મુકી શકશે અને ત્રીજું આરબીઆઇનું બેલેન્સશીટ વધુ મજબૂત બનશે અને તેની સાથે ભારતનું સોવેરિયન રેટિંગ

પણ અત્યંત ઉંચું જશે પરંતુ આ તમે કઈ રીતે કરી શકશો તે સૌથી મોટો પ્રશ્ન છે.

અવારનવાર એવા સમાચાર આવે છે કે ઘરમાં કેટલું સોનું રાખવું તે કાનુની મર્યાદા અને ભાગ્યેજ તે અંગ સ્પષ્ટતા કે કોઈ એક મત છે. લાંબા સમયથી સોના પરનું ધિરાણ વધી રહ્યું છે. સરકારે હાલમાં ૪ ચોક્કસ રકમથી વધુના ધિરાણ સમયે સોર્સ ઓફ ગોલ્ડ એટલે કે સોનું ક્યાંથી મેળવ્યું તે અંગે પુછવા અંગે પણ ધિરાણ કરતી નાણાકીય સંસ્થાઓને જણાવ્યું છે. સોનાનો આ ભંડાર અને ભારતીયોની વધતુ જતું આકર્ષણ સોનાના ઉચા ભાવથી ઘટ્યું નથી, તે નિશ્ચિત છે અને સૌથી મહત્વનું એ છે કે સરકારને જે સોનું આયાત કરવું પડે છે. તેમાં કિંમતી વિદેશી હુડીયામણનો ઉપયોગ કરવો પડે છે, જેનો પ્રોડક્ટિવિટી ઉપયોગ બહુ



સલામતી માટે છે અને દરેક કુટુંબ ધરછે છે. કાળા નાણાને છુપાવવા માટે સોનું એક મહત્વની કોમોડિટી બની ગઈ છે. તે સમયે અનેક વખત પ્રશ્ન ઉભો થાય છે કે શું એવી કોઈ

દેશના કોઈપણ નાગરિક પાસે તે આંતરરાષ્ટ્રીય ભાવે સોનું ખરીદી લેશે અને તેના પેમેન્ટમાં 65 ટકા રોકડ રકમ અને બાકીના 35 ટકા 29 વર્ષના ઝીરો કુપન બોન્ડથી આપશે. જે સ્થાનિક ભાવ છે તેની સાથે તે મેચ થઈ જશે. પરંતુ નાગરિકો તેમાં સંમત થાય છે તે પ્રશ્ન છે. એક બીજો મુદ્દો



એવો છે કે સ્ટિર્વર્ બેન્ક બજાર ભાવે સોનું ખરીદી લે અને કોઈ પ્રશ્ન પુછે નહીં આ સોનું ક્યાંથી મેળવ્યું છે.

આમ સોનાને સફેદ નાણામાં ફેરવવાની આ તક મળી શકે છે. તો જે કાળા નાણાના સ્વરૂપમાં સોનું સંગ્રહાયેલું છે તે બહાર આવી શકે છે. તેના કારણે બિઝનેસથી લઈને સામાન્ય લોકોના હાથમાં જંગી

અમેરિકાના જીડીપી અને જોબ ડેટા કોમોડિટીઝ શેરબજારની ચાલ નક્કી કરશે

વિતેલા સપ્તાહમાં વૈશ્વિક બજારો વ્યાપક રીતે હકારાત્મક બંધ થયા હતા. બજારોને યુએસ કુળાવાના ડેટા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જે અપેક્ષા કરતા ઓછો હતો. આનાથી 2026માં નીચા વ્યાજ દરો માટેના આઉટલુકમાં સુધારો થયો છે અને એઆઈ-લિક્ડ શેરોમાં પુનઃપ્રાપ્તિ થઈ છે. કરન્સી માર્કેટમાં અમેરિકન ડોલરમાં સાધારણ રિકવરી જોવા મળી હતી. તે બે મહિનાથી વધુ નીચલા સ્તરે 98થી લગભગ 1 ટકા વધ્યો હતો અને સપ્તાહના અંતે 0.3 ટકા વધીને 98.7 પર બંધ થયો હતો. આ પુનઃપ્રાપ્તિ યુએસના વિકાસમાં નવા વિશ્વાસને બદલે જાપાની યેનમાં નબળાઈને કારણે વધુ હતી.



બેંક ઓફ જાપાને તેના પોલિસી રેટને 0.25 ટકા વધારીને 30 વર્ષની ઊંચી સપાટીએ 0.75 ટકા પર પહોંચાડ્યો છે. આનાથી યેન પર દબાણ આવ્યું હતું. આનાથી ડોલરને પરોક્ષ ટેકો મળ્યો હતો. બીજી તરફ, યુરોપિયન સેન્ટ્રલ બેંકે સતત ચોથી બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે બેંક ઓફ ઇંગ્લેન્ડે તેના નીતિગત દરમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 3.75 ટકા કર્યો છે. ક્રિસમસની રજા હોવાથી નવું અઢવાડિયું વ્યવસાયની દ્રષ્ટિએ ટૂંકું છે. તેથી, કોમોડિટીના ભાવમાં અસ્થિરતા ઓછી હોઈ શકે છે. નવા સપ્તાહમાં ફક્ત થોડા આર્થિક ડેટા બહાર પાડવાના છે, ખાસ કરીને યુએસ જીડીપી, એડીપી રોજગાર ડેટા અને સાપ્તાહિક

બેરોજગારી દાવાના ડેટા. કોમોડિટી માર્કેટના આ આંકડા પર નજીકથી નજર રાખવામાં આવશે કારણ કે તેના આધારે બજારની હિલચાલ નક્કી કરવામાં આવશે.



અમેરિકામાં બેરોજગારીનો દર વધીને 4.6 ટકા થયો છે. આનાથી 2026ના અંતમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આનાથી કિંમતી ધાતુઓને તેમની રેલી વધારવામાં પણ મદદ મળી. કોમેક્સ સોનું 4387 ડોલરની નજીક

ભારત - ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી,નિકાસના નવા દ્વાર ખોલશે

ભારત - ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર આખરે બંને દેશોના સત્તાધીશો હસ્તાક્ષર કરી દીધા પછી નવા વર્ષથી આ નિકાસ પ્રોત્સાહક કરાર અમલમાં આવશે. ભારત અને ઓમાન વચ્ચે આર્થિક ભાગીદારી અને તકીના નવા યુગને આગળ વધારશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુલતાન હૈથમ બિન તારિકની ઉપસ્થિતિ અને દૂરંદેશી નેતૃત્વમાં, ભારત-ઓમાન



દૃષ્ટિએ ભારતની 99.38% નિકાસને આવરી લે છે. યુનાઇટેડ કિંગડમ પછી છેલ્લા 6 મહિનામાં હસ્તાક્ષર



કરાયેલ આ બીજો મુક્ત વ્યાપાર કરાર છે.ભારતીય માવસામા માટે અભૂતપૂર્વ માર્કેટ એક્સેસ જેમાં ઓમાનની 98.08% ટેરિફ લાઇન પર શૂન્ય-ડ્યુટી એક્સેસ છે, જે મૂલ્યની દૃષ્ટિએ ભારતની 99.38% નિકાસને આવરી લે છે.યુનાઇટેડ કિંગડમ પછી છેલ્લા 6 મહિનામાં હસ્તાક્ષર કરાયેલો આ બીજો મુક્ત વ્યાપાર કરાર છે.ઓમાને

127 પેટા-ક્ષેત્રોની ઓફર કરી છે, એક વ્યાપક પેકેજ જેમાં કોમ્પ્યુટર સંબંધિત સેવાઓ, વ્યવસાય સેવાઓ, વ્યાવસાયિક સેવાઓ, ઓડિયો વિઝ્યુઅલ સેવાઓ, R&D સેવાઓ, શિક્ષણ સેવાઓ અને આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે - જે ઉચ્ચ-મૂલ્યની તકો અને રોજગાર સર્જનના દ્વાર ખોલે છે”

રકમ રોકડમાં આવે અને તે વર્કીંગ કેપિટલ ખર્ચ તરીકે ઉપયોગમાં લેવામાં આવે. આમ આ વિકલ્પને પણ લોકો સ્વીકારે તે પ્રશ્ન છે. ભારતનો ઓફિશ્યલ વિદેશી ચલણ ભંડાર એ સોનાની કિંમતોમાં જે વધારો થયો છે તેના કારણે આસામાને છે અને સ્ટિર્વર્ બેન્ક પાસેથી પુરતા પ્રમાણમાં સોનું છે તેમજ હજુએ વિદેશી બેન્કો પાસે ભરતનું સોનું પડ્યું છે. હવે જો આરબીઆઇ એક પણ પ્રશ્ન પુછ્યા વગર સોનું લોકો પાસેથી ખરીદી લે તો બીજા લાભ એ થઈ શકે છે કે જ્યારે દેશમાં સોનાનો ભંડાર ઉંચો હોય તો લોકલ ડિમાન્ડ વધે ત્યારે આરબીઆઇ તે સોનું વેચી શકે છે.

અને તે રીતે આપણને સોનાના જે આયાતમાં મોટું વેદશી ચલણ ખર્ચવું પડે છે તેનો બચાવ થઈ શકે છે. આ માટે પણ પહેલા એ કરવું જરૂરી છે કે સોનાની જે આયાત ડ્યુટી છે તે ઝીરો કરી દેવી હોયછે. જેથી કોઈ વચગાળાની કડી રહે નહીં. આ ઉપરાંત, જવેલરીને આ સ્કીમમાં સામેલ કરવા જોઈએ જે કલેક્શન એજન્ટ તરીકે કમા કરે અને તેમને આકર્ષક કમિશન પણ આપવામાં આવે. આ સ્કીમ ટાઇમબાઉન્ડ હોવી જોઈએ. જેથી તેનો શક્ય એટલો વહેલો ઉપયોગ થાય તે શક્ય બને અને દસ વર્ષ સુધી ફરી આવી સ્કીમ થવી જ ન જોઈએ, જેથી કરીને ફરી એક વખત લાંબા સમય સુધી ચોજના નહીં આવે તેમ માનીને લોકો પોતે રહી ન જાય તે રીતે સોનું વેચવા માટે પ્રેરણા મળે.